



Date: 03 July 2025

То	То
BSE Limited	National Stock Exchange of India Limited
Phiroze Jeejeebhoy Towers	Exchange Plaza
Dalal Street	Bandra Kurla Complex
Mumbai – 400001	Bandra (E)
	Mumbai – 400051
Security Code: 540596	Symbol: ERIS

SUBJECT: NEWSPAPER PUBLICATION FOR ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING AND BOOK CLOSURE INFORMATION

Dear Sir/Madam,

In accordance with the provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copy of newspaper advertisement regarding the Notice of Nineteenth Annual General Meeting, remote E-voting and Book closure information of the Company published in Financial Express (English and Gujarati) and Divya Gujarat (Gujarati) on 03rd July 2025.

This is for your information and record.

Thanking You,

For Eris Lifesciences Limited

Milind Talegaonkar Company Secretary & Compliance Officer Membership No: A26493

FINANCIAL EXPRESS

PUBLIC NOTICE Joseph Ponding Job strates of track value. Registered Office at Herbert house 135 J. Stand Road Kolkata. West Bengal 700001. Inclain a licho is 8000°E Beaming. Delinctive Numbers from 2017°B – 30108. We hereby pive nodes that the said standard beautiful and the said of the said of the said the said with the said of the said of the said the said with the said of the said the said with the said of the said here of the said of the said of the said said share Certificates. The Public is hereby warmed against said share Certificates The Company may said share Certificates. The public is hereby warmed against said share Certificates The Company may said share Certificates. The company said share Certificates the said share Certificates the company said share Certificates the said share said

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

This is only an advertisement for information purposes and not for publication, distribution, or release, directly or indirectly in the United States of America or otherwise outside India. This is not an announcement for the offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the letter of offer dated, July 04, 2024 filed with the Stock Exchange, manely SEC Limited ("BES") and Securities and Exchange Board of India ("SEBI").



Corporate Identify Number: LOSUGN-P199-DLC.01172/6

Registered Office: wirelamapslam (Jaige, T. P. Goudr madd), Melore, Andria Pradesh-524 002

Office: Falt No. 4, Third Floor, Pallawi Apartments, No. 57/11, Old No. 29174, HDFC Bank Compoun

Tel. No.: +91 889762378 F76. de, A. Puran, Chemari-600 028

Tel. No.: +91 889762378 F76. de, A. Puran (Chemari-600 028)

Contact person: Mc Ganesan Nakanatah, Company Secretary and Compliance Officer

SECOND AND FINAL REMINIDER CUM FORFETTURE NOTICE TO THE HOLDERS OF PRRTLY PAID-UP
EQUITY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID
In terms of provisions of the Companies Act, 2013 ("Add") read with the relevant time reads thereunds; the First and First Call
Molice has been issued to such persons who were holders of the parity paid shares as on Fobruary 07, 2025, being the Record

Notice has been issued to sout persons who were notiests of the partry paid snares as on netrously Ur, 2UCo, being the record Date.

In this connection, the Rights Issue Committee of the Company ("Committee") duly authorized by the Board of Directors of the Company, by way of Cincular Resolution passed on Wednesday, (2nd. July 2025, approved sending Second and Final Reminder Cum Fortelbure Notice from time to time for payment of the First and Final Call amount of e22 25 (comprising 27.5 blowards takes on which the First and Final Call Money remains urpaid.

Accordingly, sending of Second and Final Reminder Cum Fortelbure Notice to all the members who have not paid the call money has been initiated on Wednesday, (2nd.July 2025.

The payment period is form Thursday, (10th.July 2025 to Saturday, 19th.July 2025 (both days inclusive). Eligible Shareholders shall send their First and Final Call Money by way of Demand draft payable at Chennal along with the completed payment slip by registered posts/speed post atthe effice of the Registrar of the Issue.

Please note that, failure to pay the First and Final Call Money within the period as mentioned above shall render the partry paid-up cutyly shares of the Company, including the amount arrange youtstanding on accordance with the provisions of the Act. the Article of Association of the Company and the Letter of Office. The Company shall be another arrange outstanding on accordance with the provisions of the Act. the Article of Association in the Company and the Letter of Office. The Company shall be not the restrict of the Southernbest, affect the defense of the Registrar to the Issue at below mentioned address:

ice in this regard may be addressed to Registrar to the Issue at below mentioned address



CAMEO
Cameo Curporate Services Limited
Unit: Sharat Industries Ltd — Parthy paid up to Fully paid up conversion
Subramanian Building, 1, Club House Road, Chennai-600002
Tel No.: -91 144 4002 0700
Feball Id: rights@cameoindia.com
Investor Girlevance E-Mail Id: investor@cameoindia.com

ite: www.cameoindia.com ct Person: Ms. K. Sreepriya Registration No.: INR000003753

For SHARAT INDUSTRIES LIMITED

N. GANESAN Company Secretray & Compliance Officer



ZYDUS LIFESCIENCES LIMITED [CIN: L24230GJ1995PLC025878]

Integral Corporate Park, Sownells, Clin Structure, 1982. See 1982. A seed of the Company of the Vision Structure, 1982. See 19

on the website of Central Depository Services (India) Limited at www.evotingindia.com.
Manner of registering / updating e-mail addresses:
Membersholding-shares inphysical-mode and who have not yet registered / updated their e-mail address are requested to register / update the same with MUFC intime India Private Limited (formerly known as Link Intime India Private Limited (FTACH on Company aff brice, 506 h 508, Anmanath Business Centre). Resides Calla Business Centre, Off. G. Road, Ellisbridge, Ahmedahad-380006, e-mail di ahmedabadiglin rupms mufg com or to the Company at companyserceral/graghustiller com, by sending duly filled and signed Form No. ISR-1 (along with necessary supporting documents), which is uploaded on website of the Company at https://www.zydustille.com/by-callad-filled-mode and who have not yet registered / updated their e-mail address are requested to get their e-mail address registered / updated by following the procedure of their respective DP.

registered / updated by lollowing the procedure of their respective DP.

Manner of casting vote through e-voting:

The Notice contains detailed instructions for attending the AGM through VC / DAVM and the manner of e-voting (including remote e-voting) for those members holding shares in physical mode or in dematerialized mode and who have not registered their e-mail address either with the Company or the respective DP. Members are requested to go through the same and in case of any assistance for e-voting, they may contact the Company or Central Depository Services (India) Limited or National Securities Depository Limited at the numbers mentioned in the Notice.

mentioned in the Notice.

Members are requested to note that a dividend of Rs. 11.00¹ per equity share (i.e. 1100¹k) has been recommended by the Board of Directors for the Financial Year ended on March 31, 2025, subject to the approval of the members at the ensuing AGM. The Dividend, if declared by the members at the ensuing AGM, will be paid to those members whose names stands registered in the Register of Members /List of Beneficial Owners on Friday, July 22, 2025, i.e. the Record Dividend on the Finance Act, 2020, the dividend income is tasable in the hards of members w.e. 1, April 1, 2020 and the Company is required to deduct tax at source (*TDS*) from dividend paid to members at the prescribed rates. Necessary information in this regard is provided in the Notice convening the AGM of the Company.

5. Manner of registering mandate for receiving dividend electronically:

Wendbers holding shares in physical mode and whose folios are not updated with any of the KYC details, shall be eligible to receive dividend only in electronic mode with effect from April 1, 2024, only after updation of KYC details. Members are requested to update her KYC details by submitting the KYC forms (available on the website of the Company at https://www.zydusille.com/shareholdesservices.htmlicontacdetails) duly complete and signed by the registered holder(s) to the RTA at their address on or before Wednesday, July 23, 2025. Members holding shares in demaleralized mode are requested to get their bank account details related to TDS on dividend, members may contact the RTA of the Company by sending an e-mail at ahmedaba@in.mms.mufg.com or to the Company at company-secretary@zyduslefe.com or dhavalsoni@zyduslefe.com.

For, Zydus Lifesciences Limited Sd/- Dhaval N. Soni Company Secretary Membership No. : FCS7063

SUNITA SUNITA TOOLS LIMITED

(Formerly known as Sunita Tools Private Limited)

red Off.: Survey No.66, Plot No. A, Valiv, Sativali Road, Vasai East, Palghar, Vasai East IE, Thane, Vasa Maharashtra, India, 401208 | Tel No.: 9136019995 | CIN: 129220MH1998PLC045850 Website: www.sunitatools.com | Email ID: Info@sunitatools.com

NOTICE

otice is hereby given that:

A. ANNUAL CENERAL MEETING:

He Notice is hereby your hat Thirty Eighth Annual General Meeting ("AGM") of Sunita Tools Limited (Formerly known as unital books Private Limited) ("The Company") is scheduled on Saturday, July 26, 2025 at 12:30 PM, brough Video Conference (VC) Orber Audio-Visual Mansa (OAM) to Instruct the Limited as specified.

He Notice of AGM along with the Annual Report for the financial year (FV) 2024-25 has been sent to Members in electronic more to fermille to registered with the Opesatory Participation for case of electronic scharefoldingly the company's Registered and share transfer Agent (in case of physical sharefoldingl). For members whose Email IDs are not registered, we request harefolders to update their erransfel and the depostories FRIT as soon as possible. The Notice and Annual Report may also be cossisted on the website of the company at www.sunitatools.com and website of National Securities Depository Limited (YISDI).

N. REMOTE E-VOTING:

1. REMOTE E-VOTING:

b. Inclinate E-Volume.
on complaince with the provision of Section 108 of the Companies Act, 2013 read with the rules made there under and Regulation complaince with the provision and Disclosure Regulations; Regulations, 2015. The Company has offered remote e-voling adulty for transacting the business through National Societies Depository, Limited (SSQL), to enable the members to cast the remotes to cast the remotes of the remo

- The e-voling period will commence on Tuesday, July 22, 2025 (9:00 A.M.) and ends on Friday, July 25, 2025 (5:00 P.M.) IST Thereraffer, the e-voling module will be disabled.
- Thereafter, the e-voting module will be disabled. The voting rights of Members shall be in proportion to their share of paid-up capital of the Company as on the cut-off date Salurday, July 19, 2025. Once a vote is cast by the member, he/she shall not be allowed to change it subsequently. Any person who becomes a member of the Company after dispatch of Notice and holding shares as on cut-off date may write to NSQL on the e-mail to it, evoting paids come requesting for the Iser To and password. If the member is already engineer with NSQL for e-voting, the member can use the existing User ID and Password for casting their vote through Remote e-voting. The detailed procedure pertaining to the User ID and Password is also provided in the Notice of the ASML renor information, kindly refer Notice of the meeting available on the company's website and NSQL.

C. BOUN CLUSIONE:

Presuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclore Requirements) Repulations, 2015, the Register of Members and the Share Transfer books shall remain closed from Saturday July 2025 to Friday, 25 July 2025 (both days inclusive) for the purpose of 38th Annual General Meeting.

Sd/

Place: Thane Dated: July 2, 2025

Rupal Dedhia Company Secretary& Compliance Officer

BAJAJ FINSERV LIMITED

Notice of 18th Annual General Meeting and e-voting information

NOTICE is hereby given that 18th Annual General Meeting (AsM) of the members of the Company is scheduled to be held on Friday, 25 July 2025 at 12:15 p.m. at Hotel Hyatt Regency, Opposite Weiffer (10 the Parkhager Revening 18th Age (Notice)). The said Notice along with Proxy form, attendance sign and Annual Report for the financial year 2024-25 has been sent to the members holding shares as on Friday, 20 June 2025 (cut-off date for the purpose of dispatch of Notice), through email at their registered email-ID.

emain-III.

In accordance with the Regulation 36(1)(b) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations'), a letter containing the web-link for accessing the Annual Report for financial year 2024-25 and Notice is being dispatched alongwith login credentials to the members who have not registered their email III with the Company for remote he avoiting

- Ill with the Company for remore a-board and the form of the aforesaid documents are also available on:

 1. Website of Company at https://www.aboutbajajfinserv.com/investor-relations-annual-reports.

 2. Website of Stock Exchanges i.e., BSE Ltd. (BSE) at www.bseindia.com and National Stock Exchange of India Ltd. ("NSE") at www.nseindia.com.

 3. Website of -e-voting service provider i.e., KFin Technologies Ltd. ("KFin") at https://ewoting.kfintech.com.

evoting.kfintech.com.
Pursuant to provisions of the SEBI Listing Regulations, the Company is also providing facility of one-way live webcast of the proceedings of 18th AGM. More information on the webcast is available in the Notice of 18th AGM. The Board of Directors, at its meeting held on 29 April 2025, have recommended payment of dividend at ₹1 per equity share (100%) of the face value of ₹1. Subject to the provisions of section 126 of the Companies Act 2013 (the Act), dividend on equity shares, if declared at the 18th AGM, will be credited/dispatched on or before Tuesday, 29 July 2025, to all those members holding shares as on closing hours on Friday, 27 June 2025.

In compliance with provisions of section 108 of the Act and rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and regulation 44 of the SEBI Listing Regulations and SEBI Moster circular dated 11 November 2024, the members or hereby further notified that
a) The Company is providing e-voting facility to its members to cast their vote by

- The Company is providing e-voting facility to its members to cast their vote by electronic means on the resolutions set out in the Notice of AGM.
- Remote e-voting shall commence from Monday, 21 July 2025 (9:00 a.m. IST) shall end on Thursday, 24 July 2025 (5:00 p.m. IST). Remote e-voting shall not be allowed beyond 5.00 p.m. IST on Thursday, 24 July 2025.
- beyond 5.00 p.m. IST on Thursday, 24 July 2025.

 Cut-off date for the purpose of e-voting shall be Friday, 18 July 2025 (cut-off date). A person whose name is recorded in the register of members or in the register of beneficial owners as on the said date shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting at the AGM.

 Persons who have acquired shares and become members of the Company after the dispatch of Notice and who are eligible shareholders as on the cut-off date, may obtain the User ID and Password from KFin by sending request on evoting@kfintech.com from registered email-ID. In case the members have not registered their email ID, they are requested to reach out to their respective Depository Participants for updating the same.
- Members present at the meeting and who have not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system at the AGM. The instructions for voting at the AGM are provided in the Notice.

- are provided in the Notice.

 Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM but shall not be allowed to vote again at the AGM. User ID and password for remote e-voting is sent in the email, where Notice is sent by remil and is printed on the letter sent to the members whose email-IDs are not registered with the Company or KFin.

 In case of any queries/grievances, related to e-voting, members may refer the Frequently Asked Questions (FAGS) and e-voting user manual available at https://evoting.kfintech.com/. Further, members may reach out at the contact details mentioned below for addressing e-voting related grievances:

Mohd. Mohsin Uddin Senior Manager KFin Technologies Ltd Unit: Bajaj Finserv Ltd Selenium Building, Tower-B, Plot No. 31 & 32, Financial District Nanakramguda, Serilingampally, Nanakramguda, Serilingampally, Hyderabad, Rangareddy, Telangana-500 032. Email ID: mohsin.mohd@kfintech.com/ einward.ris@kfintech.com/ Toll free no.: 1800 309 4001 Uma Shende Company Secretary Bajaj Finserv Limited 3rd Floor, Panchshil Tech Park, Viman Nagar, Pune-411014 Email-ID: investors@bajajfinserv.in Tel No.: (020) 7157 6064

Individual shareholders holding shares in dematerialized mode may reach out at the below contact details for any issues in respect of e-voting through Depositor(ies) (i.e., NSDL and CDSL)

NSDL	CDSL
Email-ID: evoting@nsdl.com Toll free no.: (022) 4886 7000 / 1800 1020 990	Email-ID: <u>helpdesk.evoting@cdslindia.com</u> Toll free no.: 1800 2109 911

epaper.financialexpress.com

For Bajaj Finsery Limited

Uma Shende Company Secretary

CIN: L65923PN2007PLC130075

Regd. Office: Bajaj Auto Limited Complex, Mumbai-Pune Road, Pune - 411 035

Tel No.: (020) 7157 6064 | Fax No.: (020) 7150 5792

Email IID: Investors@bajafinserv.in

Website: https://www.aboutbajafinserv.com/about-us

STU

STERLITE TECHNOLOGIES LIMITED

ffice: 4^h Floor, Godrej Millennium, Koregaon Road 9 Pune - 411001 INDIA .CIN: L31300PN2000PLC2024 Phone: +91-02-30514000, Fax: +91-02-30514113

NOTICE TO THE EQUITY SHAREHOLDERS [For transfer of equity shares to Investor Education and Protection Fund (IEPF) Account]

NOTICE TO THE EQUITY SHAREHOLDERS
[For transfer of equity shares to Investor

Education and Protection Fund (IEFF) Account)

This note is published pursuant to each of 12(6) of the Company shall, with switch of the Investor Education and Protection Fund (IEFF) Accounting, Audit Transfer and Refund Place, 2016 (if the Rules) notified by Ministry of Corporate Audits (MCA) as amended from the to time. The Rules, inter also, contain provisions for transfer and all the shares in respect of which dividend has not been paid or claimed by each share of all the shares in respect of which widered has not been paid or claimed by each share of the shares of the sh

Place: Pune Date: 03 July, 2025

sd/-Mrunal Asawadekar Company Secretary and Compliance Officer

Eris **ERIS LIFESCIENCES LIMITED**

NOTICE OF NINETEENTH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING AND BOOK CLOSURE INFORMATION

NOTICE OF NINETEENTH ANNUAL GENERAL MEETING, REMOTE EVOTING AND BOOK CLOSURE INFORMATION NOTICE IS HEREBY GIVEN THAT the 19" Annual General Meeting (AGM) of the Members of Eris Lifesciences Limited will be held on Friday, July 25, 2025, at 11:00 a.m. (IST) through Video Conferencing (VCT) to transact the business, as set out in the Notice of the AGM. The Company has sent the Annual Report along with Notice convening ACM on July 02, 2025, through electronic mode to all the convening ACM on July 02, 2025, through electronic mode to all the convening ACM on July 02, 2025, through electronic mode to all the Companies ACM on July 02, 2025, through electronic mode to all the Companies ACM on July 02, 2025, through electronic mode to all the Companies ACM, 2013 read with the rules thereunder and SEBI (Listing CTRTA). In accordance with all the applicable provisions of the Companies Act, 2013 read with the rules thereunder and SEBI (Listing Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 202020 dated with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 202020 dated May 05, 2020, General Circular No. 202020 dated May 05, 2020, General Circular No. 202020 dated December 28, 2020, General Circular No. 30/2020 dated December 28, 2020, General Circular No. 202020 dated May 05, 2020, General Circular No. 202021 dated June 23, 2021, Circular No. 202021 dated September 28, 2023, and General Circular No. 20/2021 dated April No. 202021 dated June 23, 2021, Circular No. 202021 dated September 28, 2023, and General Circular No. 20/2021 dated April No. 20202 dated December 28, 2022, General Circular No. 20/2021 dated April No. 20202 dated December 28, 2022, General Circular No. 20/2021 dated April No. 20203 dated December 28, 2022, General Circular No. 20/2021 dated April No. 2022 dated December 28, 2022, General Circular No. 20/2021 dated April No. 2

Istm July, 2025, ("Cut-Off Date") for the purpose of 19" AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by RTA on all resolutions as set forth in the AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Cut-Off Date i.e. Friday, 18" July, 2025.

paid-up equity share capital of the Company as on Cut-Off Date i.e. Friday, 18"-July, 2025.

The remote e-voting period will commence on Tuesday, 22" July, 2025 at 50.00 a.m.(IST) and will end on Thursday, 24" July, 2025 at 50.00 p.m.(IST). During this period members of the Company, holding shares either in physical form or in demateralized form, as on the cut-off date may cast their vote electronically. The remote e-voting module shall be disabled by RTA for voting thereather. Those Members, who shall be present in the AGM through VC Tacility and had not cast their oshall be disabled by RTA for voting thereather. Those Members, who shall be present in the AGM through VC Tacility and had not cast their oshall be disabled by RTA for voting the remote e-voting prior to the AGM may also attend forarticipate in the AGM through VC but shall not be entitled to cast their votes sign and e-voting at the AGM by members had been sent electronically been sent electronically been sent the victor say and evoting at the AGM. Any person, who acquires shares of the Company and he Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may cast her votes by Volkowing the instructions and process of e-volting as for college as for the Volting at the AGM, please for details relating to Remote e-volting and E-volting at AGM, please for control and the Volting of the AGM, no asses shareholders/members have refer to the Notice of the AGM. In case shareholders/members have

provided in the Notice of the AGM.

For details residung to Remote e-voting and E-voting at AGM, please refer to the Notice of the AGM. In case shareholders' members have any queries regarding login' e-voting, they may send an email to instaneet@in.mpms.mufg.co.in or contact on. Tel: 022-49186175.

Members are requested to carefully read all the instructions detailed in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, Manner of casting vote through Remote e-voting our e-voting during AGM.



Rs. 51.71 Crores C

SALE NOTICE

E-AUCTION

Please Note:

1) The bid incremental amount shall be Rs. 5,00,000- (Rupees Five Lakhs Only) for the Lots;

2) The bidder of Lot 1 will be given preference over the bidders of Lot 2 & Lot 3 irrespects of their bid pinks,

under section 28A of the Insolvency and Bankruptory Code, 2016, General and Technica Terms and Conditions of the E-Jucinos Sinch of the E-Jucinos Sinch Terms and Conditions of the E-Jucinos Sinch Terms and Conditions of the E-Jucinos of the E-J

Eris એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડ wed sallows રિવાર્ય એપ્લિક, ખોક નં. ૧૪૬/૧, રામલાન રો, ઓક એનનીય સ્વાતિ અંગ્લોઝની પાસે, બોડકેવ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૪. ઇમેઇલ: complianceofficerfieldisciences.com, વેમલાઇટ: www.eris.co.in ટેલી: +૯૧ ૭૯ ૬૯૬૬ ૧૦૦૦, કેમલ +૯૧ ૭૯ ૬૯૬૬ ૧૫૫ CIN: L2423CJ2007P1C049867

૧૯મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ રિમોટ ઈ–વોટિંગ અને બુક ક્લોઝરની માહિતી

૧૮મી વાર્ષિક સામાન્ય સભાવની નોટિસ રિમોટ ઈ-વોટિંગ ઓન્યું હું કહોઝરની માહિતી.

આપી નોટિસ પ્રાન્વમાં આવે છે કે બીરા લાઇકપાર્વમારના વિવિદેશના સદયોગી પડની વાર્ષિક સામાન્ય સભા (બેક્ક્રમેખ) વિવિધે તેમ્કરનિક્ષેત (VC) હારા રપ્યું જુલાઇ, ૨૦૨૧માં કહામાના રોજ સાથે ૧૫૦૦ કહાક (ST) એક્ક્રમના કહામાના પાત્ર સાથે ૧૫૦૦ કહાક (ST) એક્ક્રમના કહામાના પાત્ર સાથે ૧૫૦૦ કહાક (ST) એક્ક્રમના નોટિસમાં વિપાર્વિક સમ્યાંચીમાં લાં યોજાકો, કંપનીના રક્ષ્યક્રેણ એક સાથે કર્યા કરાયો કર્યા કર્યા કરાયો કર્યા કર્યા કરાયો કરાયો કર્યા કર્યા કરાયો કરાયો

વારથી એજીએમના તૈયુવાર ૧૮ જુલાઈ, ૨૦૨૫ના ધૂકવારના ("કંદ-અ<u>એક સર્વીયમ્")</u> સંજ બાર રહેશે. એક્ટની કહમ ૧૦૮મી જોગવાઈઓ તથા ધંખનીઝ (મેગ્લેમ્ટ એમ્પિનિસ્ટ્રેશન) સ્કલ્સ, ૨૦૧૪ના સુધારેલા દિખ્યા ૨૦૧૧ જોગવાઈઓને અનુદ્રાત તથા દિલ્લુનિટીએ અને અક્ષ્યાન્ય લોધો એક ઇન્ડિયા (લિક્ટિંગ ઓલ્સિએન્સ) સરકાર્યો અક્ષ્યાન્ય તે કર્યા હોંદ્ર લિક્ટાયોમ્ટ્રેસ) એક્લાન્યન, ૨૦૧૫ના દિમાર ૪૦ પૂજી સરકાર્યોને એજીએના નીટિસમાં દર્શાવ્યા પૂજન તમામ કરાવો ઉપર RTA હાર પૂર્વ પ્રાપ્ત આવતી કેન્દ્રીકેટ સેવારથી સર્જા કર્યા ઇન્ડિટ્સોસ્ટ સેવારથી અંદર્શની એજીએના નીટિસમાં દર્શાવ્યા પૂજન તમામ કરાવો ઉપર RTA હાર પૂર્વ પ્રાપ્ત આવતી વિત્રેશ સરકાર્યો અંદર્શની એજીએના માન્ય સ્વાપ્ત પ્રાપ્ત પ્રાપ્ત પાત્ર પ્રાપ્ત પ્રાપ્ત પ્રાપ્ત પાત્ર પાત્ર પ્રાપ્ત પાત્ર પાત્ર પાત્ર પ્રાપ્ત પાત્ર અપ્ત પાત્ર પાત્ર પાત્ર પાત્ર અપ્ત પાત્ર આપાત્ર અલ્લા પાત્ર પાત્ર પાત્ર પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર પાત્ર અપ્ત પાત્ર આપાત્ર પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર સરકાર પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર અપ્ત પાત્ર સરકાર પાત્ર અપ્ત પાત્ર સરકાર પાત્ર અપ્ત પાત્ર સરકાર પાત્ર પાત્ર પાત્ર અપ્ત પાત્ર સરકાર પાત્ર પાત્ર પાત્ર અપ્ત પાત્ર સરકાર પાત્ર પાત્ર પાત્ર પાત્ર પાત્ર પાત્ર પાત્ર પાત્ર પાત્ર અપ્ત પાત્ર પા

...અ૧૦૦૧૧ ૧૫૦ વાજ રહશ. જે સદસ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ VC મારકતે એજીએમમાં હાજર/ભાગ લઇ શકશે. પરંતુ તેઓ કરીથી મતદાન કરવા માટે હકદાર રહેશે મહીં.

ભારત બ્રિક્સ માટે કટિબદ્ધ : મોદી વડાપ્રદ્યાનનો પ દેશોના प्रवास शउ

પીટીઆઇ નવી દિલ્હી, તા. ૨

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના એક સપ્તાહ લાંબા પ્રવાસ પર દશાના એક સપ્તાહ લાબો પ્રવાસ પર જવા માટે રવાના થયા, ત્યારે બુધવારે તેમણે જણાવ્યું હતું કે, ઊભરતાં અર્થતંત્રોમાં સહકાર માટેના મહત્ત્વના પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ પ્રત્યે ભારત કટિબદ્ધતા ઘરાવે છે. ઉદ્લેખનીય છે કે, બ્રાઝિલમાં તેઓ બ્રિક્સની બેઠકમાં ભાગ

લેશે. સાથે મળીને આપણે વધુ શાંતિપૂર્ણ, સમાનતાપૂર્ણ, ન્યાયપૂર્ણ, લોકશાહી તથા સંતુલિત બહુધુવીય વિશ્વ વ્યવસ્થા માટેના પ્રયાસો કરી શકીએ છીએ, એમ તેમણે રવાના થતાં પહેલાં કહ્યું હતું.

એક સપ્તાહ લાંબા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન થાના, ટ્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ તથા નામિબિયાની મુલાકાત લેશે.સૌપ્રથમ તેઓ ઘાના પહોંચશે. મોદીએ કહ્યું હતું કે, પ્રમુખ્ પહોંચશે. મોદીએ કહ્યું હતું ક, પ્રમુખ જ્હોન પ્રમેની મહામાના આગંત્રણને પગલે બીજી અને ત્રીજી જુલાઈ સુધી તેઓ ત્યાં રહેશે. થાના ગ્લોબલ સાઇથનું મુલ્યાન ભાગીદાર છે અને આફ્રિકન યુન્યન તથા ઈતોનીયિક ડપ્યુનિટી ઓફ તેસ્ટ આફ્રિકન સ્ટેટ્સમાં તે મહત્ત્વની ભૂમિકા ભજે છે . હું બંને દેશો તચ્ચેનાં ઐતિહાસિક જોડાણોને વધુ મજબૂત કરવાનો આશય ધરાવતી મંત્રણા માટે તેમજ રોકાણ, ઊર્જા, આરોગ્ય, ચુરક્ષા, ક્ષમતા વર્ષન અને વિકાસલક્ષી ભાળીદારી સહિતનાં ક્ષેત્રોમાં સહકારનો નવો માર્ગ ખોલવા માટે ઉત્સુક છું, એમ મોદીએ

રહેશે.

યાનાના પ્રવાસ ખેડૂયા બાદ મોદી
ટ્રિનિદાદ અને ટોબેચોની મુલાકાત લેશે,
જેની સાથે ભારત ઊંડું ઐતિહાસિક,
સાંસ્કૃતિક જોડાલ પચારે,
મોદી આ વર્ષના પ્રચાસી ભારતીય
દિત્રસના મુખ્ય અતિથિ રહી ચૂકેલા પ્રમુખ
દિત્રસના મુખ્ય અતિથિ રહી ચૂકેલા પ્રમુખ
વડાપ્રધાન કચલા પ્રસાદ-વિન્સિસનર-પાર્ચી, જેમાદે તાજે તેમજ
વડાપ્રધાન કચલા પ્રસાદ-વિન્સિસનર-પાર્ચી, જેમાદે તાજે તરામાં જ બીજી દર્મ
પાર્ચી, જેમાદે લાજે તરામાં જ બીજી દર્મ

માટે ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે. ભારતીયો સૌપ્રથમ ૧૮૦ વર્ષ પહેલાં ટ્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા હતા. આ મુલાકાત ઈતિહાસના ખાસ જોડાણને પુન: જીવિત કરવા માટેની તક

કેબ એગ્રીગેટર પીક અવર્સમાં બેઝ ફેરથી બે ગણું ભાડું વસુલી શકશે

માર્ગ પરિવહળ મંત્રાલશે કેબ એગ્રીગેટર્સને પિક અવર્સ દરમિયાન બેઝ કેર કરતાં અગાઉના દોઢ ગણાને સ્થાને હવે બે ગણો વધુ ચાર્જ વસુલવાની ખંજૂરી આપી છે, જ્યારે નોન-પિક અવર્સ દરમિયાન ભાડું બેઝ ફેરના ઓછામાં ઓછા ૫૦ ટકા રહેશે. પાર્ગ પરિચન્ડન અને નાઈય મંત્રાલયે તેની મોટર વિકલ્સ એગ્રીગેટર ગાઈડલાઈન્સ, ૨૦૨૫માં જણાવ્યું હતું કે, એગ્રીગેટરને પેટ-કલમ (૧૭.૧) હેઠળ નિર્દિષ્ટ ભેડ ફેર કરતાં ઓછામાં ઓછો પ૦ ટકા નીચો અને

કેન્સલેશન યોગ્ય કારણ વિના કરવામાં

રહરા. અને લાઈસન્સ ઈશ્યૂ થયાની

ખાલવા માટ ઉત્સુક છું, અમ માદાઅ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, સાથી લોકશાહી તરીકે, ઘાનાની સંસદમાં વક્તવ્ય આપવું સન્માનની બાબત બની રહેશે.

જા ડાણન પુન: જીવત કરવા માટના તક પૂરી પાડશે, એમ વડાપ્રધાને જણાવ્યું હતું. એ પછી તેઓ આર્જેન્ટિનાની રાજધાની છુએનોસ એરીસ પહોંચશે અને ત્યાર બાદ છ અને સાતમી જુલાઈના રોજ રીયો ડી જનેરોમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહેશે.

ફોર્મ નં.-યુઆરસી-ર્ બર્ષિનિયમના XX પાર્ક

માર્ગ પરિવહન મંત્રાલયે કેલ

પારા માન માત્ર મા

દંડ ડ્રાઈવરને ફટકારવામાં આવશે. જ્યારે પેસેન્જર દ્વારા આવું

કન્સલંકાર યોળ્ય કારણ વિના કરવામાં આવે, ત્યારે પેસેન્જર પર સમાન દંડ લાગુ થશે. માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એગ્રીગેટર તરીકેના લાઉસન્સ માટે અર્થેન સિંગલ-વિન્ડો ક્લિયરન્સ માટે પોર્ટલ વિકસાવશે. એગ્રીગેટર દ્વારા ુ તાવલ ગુકવવાપાત્ર લાઈસન્સ ફી રૂપિયા પાંચ લાખ રહેશ.

અને લાઇસન્ય ઝરલૂ વયાપા તારીખથી લઈને પાંચ વર્ષના ગાળા માટે માન્ય રહેશે, એમ તેમાં જણાવવામાં આવ્યું હતું. એગ્રેગેટર્સે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, પ્રાઈવરો રૂપિયા પાંચ લાખ અને રૂપિયા દસ લાખનો અનુક્રમે હેલ્થ

🐻 बैंक ऑफ़ बड़ीदा Bank of Baroda

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE

ા દિસ્ટા મોરોકા, મશીનગર (ઈસ્ટ) શાળા : શર્વિલ એવન્યુ, સામે. દક્ષિણી અન્ડર કોયાશા, મહિલગર (ઈસ્ટ), અમદાવાદ-૩૮૦૦૮. ગુજરાત, ભારત. ૦૦૯) ૨૨૦૨૦૩૮૫ (D), ૨૨૦૨૧૦૦૦ (G) મોલાઇલ : ન્દલ ૭૩૬૦૬૩૨૯ માર્ચા : manasakhankharanda com

501જા जोटीस परिशिष्ट I-IV (बुओ नियम ८(९) (इंडत वंगम मिसङत मार्टे)

ાત વ્યાગ તાલ ૪૦ દિવસાના ચૂક્યલાના શાદતા આપા હતા. તો બેંકની લીધો ટેક્સ પટત કરવામાં નિષ્ફળ જવાથી લોન લેનાર અને સામાન્ય ને સુચના આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્સોરિટી ઇન્ટરેસ્ટ કોમ્પેન્ટ સુવા અરુલ માનિયમ ર સામે લોસેલા કાસદાની કરાય ગર્ન મીચે ગ્રા કરાય (સે તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે વારીલ મિલક્ત મિલક્ત રફ જુન ગુલા ગ્રાહ્મ

રહસ્ય યુક્તીની છે. જાણકાર્તાને ખાસ અને ભરેત જનાને સામાનાત . રોતવાર્થી આપવામાં આવે છે કે તે જે જાણકાર્તાને ખાસ અને ભરેત જનાને સામાનાત . રોતવાર્થી આપવામાં આવે છે કે તે જે જાણકાર્તાને ખાસ અને જનાને આ આવતાં હોયોપા અહારનો વ્યવસાર તે મિલકત ઓંગોના છે કરી છે. ભારતને હોયોપા અહારના તાર. ૧૦-૧૦-૧૦ સુધીની તુ લે દીધી રક્ષ્ય કુ ૧,૬૮,૪૪૫. (ફરિયા અહાર લાભ અલ્લસ્ત હુનસ સુધીની તુ લે દીધી રક્ષ્ય કુ ૧,૬૮,૪૪૫. (ફરિયા અહાર લાભ અલ્લસ્ત હુનસ સુધીની તુ લે દીધી રક્ષ્ય કુ અને અન્ય ખાસોને સારાસ્ત્રો ઓક્ર અને અન્ય ખાસોને પાયો પાયો અલ્લા સ્ત્રાસના આદીના વર્ષોના વારાસ્ત્રાસના આદીના વર્ષોના વારાસ્ત્રાસના આદીના સ્ત્રાસના હારાસના આદીના સ્ત્રાસના સ્ત્રા

જંગમ મિલકતનું વર્ણન

જેટોમ Heider તું વધારા ઉપરોક્ત મિલન તીથે મુજર સીમાળહું છે : સ્ટોક (ફુકાન પર ઉપલબ્ધ માલ) અને બુક કેટ્સનો તમામ ગીરો CERSAI ID 4000671955, જેમાં ભેર્કિક, લેટ્સ, શ્રીનગર સોસાયટી ગીતા મંદિર પાસે, અમદાદાદ, પુરુવાર પિંચ ૩૮૦૦૨૨ તોંધ : અમે આ સાથે ટેક્સિનલ કારણોસ્ટ ૨૧-૦૨-૨૦૨૪ ના રોજની પાછલી SARFAESI 13(4) લેટ્સને તીઢિક પાસી ખેંચી રહ્યા છીએ અને ૨૬-૦૨-૨૦૨૫ ના રોજ નવી SARFAESI 13(4) હબને નીઢિક પાસી બેંચી રહ્યા છીએ અને ૨૬-૦૨-૨૦૨૫ ના રોજ નવી SARFAESI 13(4) હબને નીઢિક પાસી કરી રહ્યા છીએ.

ચીફ મેનેજર અને

અધિકૃત અધિકારી ફોર્મ એ

સાર્વજનિક જાહેરાત આવેજનિક જાહેરાત પ્લોવ્યનથી અને એ-ક્રપ્ટલી ભોક છોક છઉંક્યા (સ્વેચ્છ કડ્યા પ્રક્રિયા) નિયમનો, ૨૦૧૦ નો નિયમન 2ક નેચરેલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લીમો ટેક ના સ્ટેકહોલ્ડરોની જાણકારી માટે

ની શકશે	q.	કોર્પોરેટ પર્સનનું નામ	નેચરેલ (ઇન્ડિયા) પ્રાઈવેટ લીમીટેક	
-00 000 00	۶.	કોર્પોરેટ પર્સનના સંસ્થાપન તારીખ	૨૨ ફેબ્રુઆરી, ૧૯૯૧	
ઈન્શ્યોરન્સ અને ટર્મ ઈન્શ્યોરન્સ ારાવતા હોય, એ જરૂરી છે.	3.	ઓશોરીટી વેળા હેઠળ કોર્પોરેટ પર્સન ઇનકોર્પોરેટેડ/રજીસ્ટર્ડ છે	કંપની રજીરટ્રાર, અમદાવાદ, ગુજરાત	
	8.	કોર્પોરેટ પર્સનનો કોર્પોરેટ ઓળખ નંબર / લીમીટેડ લાચબીલીટી આઇડેન્ટીફીકેશન નંબર	U65990GJ1991PTC163792	
AFFIDAVIT I, Deepa R. Matta, Aged about 58 years, W/o, Sri, Rajendra Mohanial Matta,	ч.	કોર્પોરેટ પર્સનની રજીસ્ટર્ડ ઓફીસ અને મુખ્ય ઓફીસ (જો કોઇ હોય તો) તેનું સરનામું	ઋઘડસ કોર્પોરેટ પાર્ક, સ્ક્રીમ નં. દૃર, સર્વે નં. પરદૃ, ખોરજ વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ.જી.હાઈવે,ગોતા, દરકોઈ, અમદાવાદ –૩૮૨૪૮૧. ગુજરાત	
Residing at No. C-103, Mantri Terrace, Bannerghatta Main Road, Behind Ranka	ξ.	કોર્પોરેટ પર્સનના કડ્યાની સરઆતની તારીખ	૧ જુલાઈ, ૨૦૨૫	
colony, Bliekarhalli, Bengaluru – 560 076, (share holder in Shop No. G-3, in Bombay Market Art Silk Co-0p. Society Ltd., Umarwada, Surat) hereby declare that both the names i.e., Sonali R. Matta and Despa R. Matta are one and the same person. Vide affidavid badded 20.06 2025 swom to before Chief Librarian (Sazetted Officer), Hibl Court of Kamataka, Banoalous	ø.	ફડવા અદિકારીનું નામ, સરનામું, ઇમેઇલ એફ્સ, દેવિફોન નંબર અને રસુસ્ટ્રેશન નંબર	જી દિવિષકુમાર નદવરલાલ જનગડ co3/co3, સરકોલ લાં/ટ્રાં, સરકરાતી એપાર્ટમેન્ટ, ભાવલાર લાં કરેકે, ભૂટર કર્યુલ પાસે, જુલા નગર કોર રોડ, ગુંદાવાડી, એપીરી પુત્તે, મુંબઈ-૧૦૦૦ફર લોકોફ્સફલક્ટિમેટનાર્ક્સ com+0+9-82/14/2587 IBBIPP-A01IP-P-002332017-2018/10462 પગલ્લવાલા માટે કીમીલા પગલ્લવાલા માટે કીમીલા	

ાથી અહીં નોટીસ આપવામાં આવે છે કે **નેચરેલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડે** ૧ જુલા

ર૦૨૫ ના રોજસ્વૈજીક કડ્યાની શરૂઆત કરી છે. **નેચરેલ (ઇન્ડિયા)પ્રાઇવેટ લીમીટેક** નાસ્ટેક હોલ્ડરોને વિગત નં.૭સામે જણાવેલ સર્ પર ફક્યા અધિકારીને ૩૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ અથવા એ પહેલા તેમના દા પુરાવા જમા કરવા જણાવામાં આવે છે. ણાંકિંગ કેડિટરો કહત ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા દાવાઓના

છ. અન્ય તમામ સ્ટેક હોલ્ડરો 'જાતે, અથવા પોસ્ટ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિં! દાવાના પુરાવા સુપરત કરી શકે છે. ખોટા અને ગેરમાર્ગે દોરતા પુરાવાઓની સુપરતગી દંડને પાત્ર બનશે.

સ્થળ: મુંબઈ

STERLITE TECHNOLOGIES LIMITED

NOTICE TO THE EQUITY SHAREHOLDERS [For transfer of equity shares to Investor Education and Protection Fund (IEPF) Account]

snarenioners for Seven consecutive years or more to the central count of LEPF Authority. Shareholders are requested to note that the final dividend declared for the financial year 2017-18, which remained unpaid or unclaimed for a period of seven years will be due to be recredited to the IEPF in August 2025. The corresponding shares on which dividend amount was unclaimed for seven consecutive years will also be transferred as per the procedur.

In dase no varied calim in respect of requiry sames is reconvex unariate samestance by year. (a) 2005, the Company shall, with a view to comprising with the requirement sets of ut in the requirement sets of ut in the rules, transfer the shares to "DEMA" account of the IEPF Authority" by the due date, in white out any further motion, aper the procedure stipulated the Neuter which is as under.

I. In case of shares held in physical form: the original share certificately registered in the name of the shareholder will stand automatically cancelled the shareholder will stand automatically according to the shareholder will set the shareholder will stand automatically according to the sharehol

In case of shares held in physical form: the original share conflicate(s) englisted in the name of the armsholder will stand standstally accessed and be deemed non-negotiable and the shares will be transferred to IEPF Account by usaing depiciales than certificates.

In sees of shares are held in demat form: your domat occurs will be debited by insafered have self-able to debited by insafered shares enterly to IEPF Account will be debited by insafered have self-able to the self-able of the self-

તારીખઃ ૦૩ જુલાઇ, ૨૦૨૫ સ્થળઃ અમદાવાદ

TEXMACO INFRASTRUCTURE & HOLDINGS LIMITED

NOTICE TO SHAREHOLDERS
Transfer of Equity Shares of the Company to the Investor
Education and Protection Fund (IEPF) Account

dotice is hereby given pursuant to the provisions of Section 124 of the Comp txt, 2013 read with the Investor Education and Protection Fund Auth Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ('Rules') (Including

in case no valid claim in respect of unclaimed dividend is received from Shareholders by 10th September, 2025, the Company, in accordance he said Rules, shall transfer, credit the shares and dividend for the y 2017-18 to the IEPF Account on or after 10th October, 2025 without giving surfare ratios.

SUNDARAM BRAKE LININGS LIMITED

CIN: L34300TN1974PLC006703 Regd. Office: Padi, Chennai – 600 050 +91 44 2625 7853: Fax: +91 44 26254770; Website: wwn

NOTICE OF 51ST ANNUAL GENERAL MEETING
NOTICE is hereby given that the 51st Annual General Meeting
(AGM) of the members of Sundaran Brake Linings Limide (the
company) will be held on Thursday, 24th, July 2025 at 04.45 PM
(CAWN) to the members of Sundaran Brake Linings Limide (the
company) will be held on Thursday, 24th, July 2025 at 04.45 PM
(CAWN) to transact the ordinary and special businesses as set out
in the Notice of AGM, in compliance with the applicable provisions
of the Companies Act, 2013 ("Act"). General Circular No.
09/2024 dated September 19, 2024, issued by the Ministry of
Comporate Affairs (MCA) and circular issued by SEBI vide circular
no. SEBI HO/ CFID (CFIPO-D-2) P/ CIR/2024/ 133 dated October
3, 2024 ("SEBI Circular") and other applicable crucialrs, permitted
no. SEBI HO/ CFID (CFIPO-D-2) P/ CIR/2024/ 133 dated October
3, 2024 ("SEBI Circular") and other applicable crucialrs, permitted
no. Explain and the company of the complainted copy of Annual
Report along with the Notice of AGM for the financial year 2024-25
will be sent only to the shareholders whose email addresses are
registered with the Company/ Depository Participant(s). These
documents are available and can be downloaded from the
Company's website https://www.tvsbrakelinings.com/sebi-24-25.php, website of the Slock Exchanges i. R. National Stock
Exchange of India Limited and BSE Limited at and
www.nseindia.com and www.bseindia.com respectively and
on the website of NSDL www.vsbrakel.com NOTICE OF 51ST ANNUAL GENERAL MEETING

Manner of casting vote(s) through e-voting:

The Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM through Remote e-voting or e-voting system at the AGM provided by NSDL.

All the members are informed that:

(a) The cut-off date to determine the eligibility to vote by electronic means or at the AGM is Thursday, 17th July, 2025.

(b) Remote e-voting shall commence on Monday, 21st July, 2025 at 9:00 A.M and shall end on Wednesday, 23rd July, 2025 at 5:00 P.M after which e-voting platform shall be disabled by NSDL

(c) Members who shall be present in the AGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

(d) Members who have cast their vote by remote e-voting pri the AGM may also attend/ participate in the AGM thro VC / OAVM but shall not be entitled to cast their vote again.

VCI_UAVM but shall not be entitled to cast their vote again.

(e) Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as of the cut-off date; may betain the login ID and password by sending a request to evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User Id and password for casting their votes.

If you have not registered your email address with the Company/Depository you may please follow the below instructions for obtaining the login details for e-voting.

instructions for obtaining the login details for evoting.

a) In case shares are held in physical mode, please provide Folio No. Name of sharenoider, teans details, scanned copy of the share certificate (front and back), PAN (self-fattested scanned copy of PAN card), AADHAR (self-fattested scanned copy of AAdhar Card) for registering email address by sending a request to the RTA at kalyan@integrated.co.in

In case shares are held in demat mode, please contact the Depository Participant (DP) and register your e-mail address in your demat account, as per the process advised by your DP.

Joining the AGM through VC/OAVM:

The Members will be provided with a facility to attend the AGM through VC/OAVM through the NSDL e-Voting system. The detailed instructions and steps to be followed for attending the AGM are explained in the Notice of the AGM.

The Company has appointed Mr. V. Suresh (Partner, V. Suresh Associates, Practising Company Secretaries) as the 'Scrutinizer' to scrutinize both the Remote e-Voting process and e-voting at the AGM in a fair and transparent Manner.

Pursuant to Section 91 of the Companies Act, 2013, and all other applicable Laws, the Register of Members and Shart Bobks of the Companies Act, 2013, and all other applicable Laws, the Register of Members and Shart Bath

purpose of 51st AGM.
In case of any queries or grievances relating to electronic voting, Members may refer to the "Frequently Asked Questions" (FACs) and e-voting User Manual for members available at the "Downloads" Section of NSDL's e-voting website: www.evoring.nsdt.com or call on 0.022-4880 *000 and 022-24887 *000 or send request to Ms Prajakta Pawle at evoting@nadl.co.in or contact Ms. Prajakta Pawle at evoting@nadl.co.in or contact Ms. Prajakta Pawle saksistant Manager, NSDL, Trade World, "A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg. Lower Parel, Mumbai-400013 at the designated e-mail IDs: evoting@nadl.co.in

For Sundaram Brake Linings Limite Sd/-J.R. Vishnu Varthan Company Secretary

AXIS BANK રજીસ્ટર્ડ ઓફીસ : એક્સિસ બેંક લીમીટેડ "ત્રિશુલ", ત્રીજે માળ, સમર્થેશક મંદિર સામે, લો ગાર્ડન પાસે, એલિસબ્રિલ

ાતિ, "કલ્પ ટુલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન એલએલ

Place: Pune Date: 03 July, 2025

એરિસ લાઇકસાયન્સિસ લિમિટેડ વતી મિલિંદ તાલેગાંવકર કંપની સેક્રેટરી એન્ડ કમ્પલાયન્સ ઓફિસર મેંબર નં. Az6493

રાજ્યના અનેક રસ્તાઓની હાલત ખસતા

રાજ્યના ખરાબ રસ્તાઓ તાત્કાલિક અમદાવાદના ઓઢવમાં ટ્રક નીચે રિપેર કરવા CMએ આપી સૂચના

રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે

એન.જી. ડબગર અમદાવાદ,તા. ર राજ्यमां भारे वरसाहने પગલે અનેર રોડ-રસ્તાઓની હાલત ખસતા છે. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પડેલા ખાડાઓને રિપેર કરવા માટે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે ગાંધીનગરમાં મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદની સ્થિતિને લઈ સમીશા કરવામાં આવી અને રાહત બચાવ. જળાશયોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા

અધિકારીઓને સૂચના આપી છે.



વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. અ સિવાય શાળા પ્રવેશોત્સવમાં મંત્રીઓ તથા અધિકારીઓને થયેલા અનભવો સહિતની વિગતો પર સમિક્ષા કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા કરવામાં

સંકુલમાં બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઝર ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સખીની મિનરલ વોટર બોટલ પ્લાન્ટની સ્થાપના કરાઈ છે સચિવાલયમાં રીયઝેબલ ગ્લાસ બોટલિંગ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાં પ્લાસ્ટિક બોટલના સ્થાને ગ્લાસ

ુ. બીજી તરફ સચિવાલય બોટલનો રીયુઝથશે. અસામાજિક તત્વોનો આતંક શરૂ

અમરાઈવાડીમાં જૂની અદાવતમાં ઘરમાં ઘૂસીને તોડફોડ

પોલીસે જિતેન્દ્ર સોલંકીની ફરિયાદ દાખલ કરી છે ફરિયાદી જિતેન્દ્ર આરોપી ગૌતમનો દૃશ્મન છે

અમદાવાદ.તા.૨ અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક એક્શન શરૂ કર્યા હતાં. રથયાત્રા સમયે શહેરમાંથી અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર સહિતની

કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ રથયાત્રા પૂર્ણ થતાં જ પોલીસનો ડર પૂર્ણ થઈ ગયો હોય તેમ ગુનેગારો ફરી સક્રિય થઈ ગયાં છે. શહેરના અમરાઈવાડીના વઢિયારીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.સામાન્ય બોલાચાલી બાદ છરી, ઘૂસીને હૂમલો અને તોડફોડનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપારા હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે

અમદાવાદના અમરાઈવાડી विस्तारना વઢીયારીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડકોડનો બનાવ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ પોલીસ અને કાયદાના કોઈપણ ડર વિના છરી, તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસીને હુમલો કરીને તોડફોડ કરી હતી. આ હુમલામાં ઘર અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.

અદાવતમાં બબાલ થઈ હતી.

આ અંગે ACB કુણાલ દેસાઈએ કહ્યું હતું કે, પોલીસે જિતેન્દ્ર સોલંકીની ફરિયાદ દાખલ કરી છે. કરિયાદી જિતેન્દ્ર આરોપી ગૌતમનો દુશ્મન છે. બંને સાથે ફરતા હોવાથી આ હુમલો કરવામાં આવ્યો છ. આરોપીઓ વચ્ચે અગાઉની અદાવતમાં બબાલ થઈ હતી. ત્રણ **इश्यादीना** દારે આવીને આરોપીઓએ તોડફોડ કરી હતી. આરોપીઓ વિરૂદ્ધ ગુના નોંધાયા છે. ગઈકાલે રાત્રે અમરાઈવાડીમાં હુમલો કરી તોડફોડ કરી હતી.

વોટસએપ ઉપર

બુકલેટ તુરંત મેળવો

સિમલા-મનાલી-ડેલહાઉસી-વેષ્ણોદેવી

નેનીતાલ-મસુરી-કોર્બેટ પાર્ક

नेपाण-पोખरा-चितवन नेशनल पाड

ગંગોત્રી-ચમનોત્રી-બદ્રીકેદાર

દાર્જિલિંગ-ગંગટોક-લાચુંગ-ચુમથાંગ

બેંગ્લોર-મેસુર-ઉટી-રામેશ્વ**ર**

લેહ-લડાખ-નુદ્મા-પેંગોંગ લેક

આંદામાન-પોર્ટબ્લેર-હેવલોક બીચ

ભુતાન-પારો-શીંમ્પુ-પુનાખા

કપલ દુરો

અમદાવાદમાં ૧૯૫૦થી પ્રવાસનું આચોજન કરતી કંપની

રેલવે /2x2 ac Bus / AIR પેકેજ ઢારા કપલ તથા ફ્રેમીલી ટુરોમાં જવાના ફ્રાયદા

LOWEST AIR PACKAGES

- 🖈 હપ વર્ષના પેકેજ દુરના અનુભવી સંચાલકનું માર્ગદર્શન
- ± ઊંચા દરની સ્વચ્છ, સુંદર હોટલોમાં રાત્રી
- 🛨 દરરોજ ગુજરાતી સ્વાદિષ્ટ ભોજન, મીનરલ | સ્પેશચલ કેરાલા સાથે મુભ્રાર થેકડી વોટરનો આંતદ
- 2x2 Ac/Non Ac બસમાં આરામદાચી પ્રવાસનું આયોજન
- 🖈 દુરના સાથે અનુભવી મેનેજરનું માર્ગદર્શન ★ ક્યાં જમીશુ ? ક્યાં રોકાઇશું ?
- 🛨 કયાં શું શું જોઈશું ? તેની ચિંતા નહી
- * ગુજરાત ટુરીઝમ માન્ય LTC સર્ટીની સુવિધા
 - **૭૫ વર્ષથી આપની સેવામાં**

અખિલભારત દુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રા. લિ.

સૂર્યા કોમ્પ્લેક્ષ, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુર સી.જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ (O) 26564488 / 26568833/26569979

(M.) 9375527702 / 03 /04 / 06 / 07 સ્વતંત્ર હોટલ-વાહન- AIR બુકિંગ પણ કરી આપવામાં આવશે. www.akhilbharat.in

આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

પડતું મૂકી યુવકે આપઘાત કર્યો



બી.એન. ડબગર અમદાવાદ.તા. ર

અમદાવાદમાં થાી આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તાર પાસે એક ટક પાર્ક કરેલી હતી અને ડાઇવર ટકમાં બેઠો હતો. ત્યારે એક અજાણ્યો શખસ અચાનક તેની આસપાસ આંટાફેરા મારે છે અને જેવી જ ટ્રક આગળ વધે છે કે, તુરંત આ અજાણ્યો શખસ ટ્રકના ટાયર નીચે સુઈ જાય છે અને પોતાનું જીવન ટૂંકાવી દે છે.

अभहावाहना ઓઢવ વિસ્તારમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અજાણ્યો શખસ ટુક નીચે સૂઈને આપઘાત કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો ઓઢવની પામ હોટલ પાસેનો હોવાનં માનવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, હોટલની બહાર એક ટ્રક પાર્ક કરેલી છે અને તેની અંદર ડ્રાઇવર

પણ બેઠો છે. આ દરમિયાન એક અજાણ્યો શખસ ટ્રકની આસપાસ આંટાફેરા મારી રહ્યો છે. ટ્રક જ્યારે ચાલ થાય છે તો અચાનક આ શખસ ટ્રકના ટાયરની નીચે સુઈ જાય છે. ડાઇવર આ વિશે અજાણ હોય છે તેથી તે ટક ઉપાડી મકે છે.

જેવી ટ્રક આગળ ચાલે છે ટાયરની નીચે સૂતેલો વ્યક્તિ કચડાઈ જાય છે અને તેનું મોત નિપજે છે. નોંધનીય છે કે. આ વીડિયો ક્ચારનો છે તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી. ઓઢવ પોલીસે આ વીડિયોના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીએ અલગ-અલગ ટીમ બનાવીને યુવકની ઓળખ કરી રહી છે, હાલ આ યુવક કોણ છે તેની ઓળખ ન થવાના કારણે આપઘાત કરવાનું કારણ સામે આવ્યું નથી.

Eris

એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડ રજીસ્ટર્ડ ઓક્રિસ: શિવાર્થ એમ્બિટ, પ્લોટ નં. ૧૪૨/૨, રામદાસ રોડ, એફ એસબીઆર સ્વાતિ બંલ્લોઝની પાસે, બોડકંદ, અમદાવાદ, ગુજરાત-3૮૦૦૫૪.

૧૯મી વાર્ષિક સામાન્ય સભાવી નોદિસ ક્યોર ઈ-વોર્ટિંગ અને બું ક ક્લોઝરની યા હિતી આથી નોદિસ પ્રાક્વામાં આવે છે. એવિસ લાઇક્યાયનિસ લિમ્ટેડના સદસ્યોની ૧૯મી વાર્ષિક સામાન્ય સભા (ત્રેજીએમ) લિમિશે કોન્કરનિંગ (VC) હાર રપ, જુલાઇ, ૨૦૨૫ના ક્યારાના રોજ સવારે ૧૫૦૦ હાર્કા કર્યા, જુલાઇ, ૨૦૨૫ના ક્યારાના રોજ સવારે ૧૫૦૦ હાર્કા કર્યા, ભારત કેન્સ તેમ્યુનેજી જેવારા કર્યા કર્યા કર્યા કરાઈટ લિમ્ટિડ (બ્લાઇ મેરા કર્યા મારા કર્યા કર્યા

રોજ લંધ રહેશે.
- એક્ટની કલમ ૧૦૮ની શ્રેગ્લાઈએ તથા કંપનીઝ વિજેષ્યરેન્ટ એન્ડ એવિનિસ્ટ્રેશન) કેસ્ટની કલમ ૧૦૮ની શ્રેગ્લાઈએ તથા કંપનીઝ વિજેષ્યરેન્ટ એન્ડ એવિનિસ્ટ્રેશન) કેસ્ટની કલમ ૧૦૮ની શ્રેગલાઈઓને અનુદ્રમ તથા સિય્લુટિટિઝ એન્ડ એન્ડમને કર્યું હતા કે આ છે. ઉપેપા (સિર્ટિગ ઓનિસ્ટ્રેયન) કેસ્ટને એક્ટ ઉપેપા (સિર્ટિગ ઓનિસ્ટ્રેયન) કેસ્ટને એક્ટ ઉપેપા (સિર્ટિગ ઓનિસ્ટ્રેયન) કેસ્ટને મોટિસ્સા દેશોલા પૂષ્ટ પાત્રમાં સ્ટ્રેયની એક્ટરેસ કિસ્ટ્રોયન કેસ્ટ્રેયન કેસ્ટ્રોયન કેસ્ટ્રેયન કેસ્ટ્રિયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રિયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રિયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રિયન કેસ્ટ્રેયન કેસ્ટ્રેયન કેસ્ટ્રિયન ક

રાખવામાં આવેલા ઇક્વિટી રોસ્તા પ્રમાણમાં છો. દિમોટ છે-વીટિંગનો સમયગાથી ૨૨ જુલાઇ, ૨૦૨૫ના મંગળવારના ૧૬ કર્ય દળ 5 કર્યક (દિગ) ૧૬ થયે અને ૧૨ જુલાઇ, ૧૦૨૫ના ગુલ્લાસ્ત્રા રોજ સાંજે ૫:૦૦ 6 લાઇ (દિગ) ૧૬ થયે અને ૧૨ જુલાઇ, ૧૦૨૫ના ગુલ્લાસ્ત્રા રોજ સાંજે ૫:૦૦ 6 લાઇ (દિગ) પૂર્ણ થયે. આ સમયગાળામાં કટ-ઓક-નારીમ બેતિક સ્વરૂપ્ય મોત તેમનો મત આપી શકે છે, ૧મોટ ઈ-વીટિંગ મોપુલને RTA હારા ત્યારબાદ ખાદ્યા પ્રદે અલમ ક્વાનાં આવશે. એજીએમાં પે ૦ સુચિયા હારા પુજર રહેના; સ્વરૂપ્ય જેમણે રિમોટ ઈ-વીટિંગ હારા કરાવ ઉપર પોતાનો મત આપ્યો નથી, તેઓ અન્યથા આમ કરવાથી પ્રતિબંધિત નથી. તેઓ એજીએમ દરમિયાન ઈ-વીટિંગ સિસ્ટમ ઢારા મતદાન કરવા માટે પાત્ર સ્ટેસી

મતદાન કરવા માટ પાત્ર રહશ. જે સદસ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ VC મારકતે એજીએમમાં હાજર/ભાગ લઇ શકશે, પરંતુ તેઓ ફરીથી મતદાન કરવા માટે હકદાર રહેશે નહીં.

હક્રમાં રાદમાં થઇ. કોમગ્રીસ્પિલાઈઝ્ડ મોડ, ક્રિઝિકલ મોડમાં શેર ધરાવતા સદસ્યો દ્વારા એજીએમમાં રિપોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ કરવાની પહાતિ તથા જે સદસ્યોએ તેમના ઈમેલ એપ્રસની નોંધણી કરવી નથી તૈમના ઈ-મેલ એપ્રતની નોંધણી કરવાની પ્રક્રિયા એજીએનની નોટિસમાં આપવામાં આવી છે.

નાદત્તાના આપવાના લાગા છે. કોઈપણ વ્યક્તિ કે જેમણે કંપનીના શેર લીધાં છે તેમજ કંપની દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે નોટિસ મોકલાવ્યાં બાદ કંપનીના સદસ્ય બન્યાં છે અને કટ-ઓક તારીએ શેર ધરાવે છે, તેઓ એજીએમની નોટિસમાં આપવામાં આવેલી સૂચનાઓ અને ઈ-વોટિંગની પ્રક્રિયાને અનુસરીને તેમનો મત આપી શકે છે.

પ્રક્રિયાને અનુસરીને તેમનો મત આપી શકે છે. એજીએમનો સિંગેડ ઈ-વોરિંગ અને ઈ-વોરિંગને સંબંધિત વિગતો માટે, કૂપા કરીને એજીએમની નીટીનનો સંદર્ભ લો. જો સેરધારહો/સદસ્યીને લોગિન/ઈ-વોરિંગ અંગે કોઈ પ્રક્ષી હીય, તો તેઓ instameet@in.mpms.mufg.co.in ઉપર ઈમેલ મોકલી શકે છે અથવા સંપર્ક કરો: - ટેલિકોન ૧૦૨ - ૪૯૧૮૬૧૭૫ સદસ્યીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એજીએમની નીટિક્શમાં વિગતવાર દર્શાવેલ તમામ સ્થાનાઓ એ વિગ્રેષ્ઠ કરીને એજીએમનો જોડાવા પ્રની સુધનાઓ, એજીએમમાં રિમોર ઈ-વોરિંગ અથવા ઈ-વોરિંગ દ્વારા મત આપવાની રીત ધ્યાનપી વાંગ

એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડ વતી મિલિંદ તાલેગાંવક

પરિવહન માટે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે

સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ

કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે

ગાંધીનગર,તા. ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ક્રેન્ડલી રિયઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે. પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવા સચિવાલય કેમ્પસમાં મહિલા મંડળ દ્વારા નવા સચિવાલય બ્લોક નંબર ૧૩ના ગ્રાઉન્ડ ક્લોર ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે.

આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાન પાશી પૂરું પાડવામાં આવવાને કારણે



પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે.

માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ અને ટીમે વિકસાવેલી છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે.

આ પ્રકારનો પાયલોટ પ્રોકેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો.

અહીં પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે. એટલું જ નહીં. અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે.

વ્યાજખોરોના ત્રાસ યથાવત

નારણપર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી

એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે યુવાન ગઈકાલે ભાનમાં આવ્યો હતો

જામનગર,તા. ર

જામનગર તાલુકાના તારણપર ગામમાં રહેતા ૨૭ વર્ષના રીક્ષા ચાલક યુવાને બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી. જે ભાનમાં આવી જતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ નારણપર ગામના જ બે વ્યાજ ખોરો સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નારણપર ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા મિલન પાલાભાઈ ખરા નામના સત્યાવીસ વર્ષીય યુવાને પરમદીને રાતે પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યો હતો. જેને ૧૦૮ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જે યુવાન ગઈકાલે ભાનમાં ખાવ્યો હતો, ત્યારબાદ પંચકોષી બી. ડિવિઝન ના એ.એસ.આઇ. ડી.જી. ઝાલા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું, જેમાં પોતે નારણપર ગામના જ બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હોવાથી આ પગલં ભરી લીધં હોવાનં જણાવ્યું હતું. નારણપર ગામના કલ્પેશ ઉર્ફે લાલો કાંતિભાઈ લખુભાઈ ચાંદ્રા પાસેથી પોતાની બીમારી સબન આજથી પાંચ વર્ષ પહેલા ૧ લાખ ૪૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા જેનું ત્રણ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું

પ્રતિનિધિ હારા નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર હોવા છતાં હજુ પઠાણી ઉઘરાણી કરાતી હતી. જ્યારે આજથી બે વર્ષ પહેલા દિનેશભાઈ લખુભાઈ નંદા नामना नारखपर गामना शप्स પાસેથી ૫૦ હજાર રૂપિયા ૧૦ ટકા લેખે લીધા હતા, જેન પણ વ્યાજ અને મૂળ રકમ ચૂકવી દીધી હતી. એક તબક્કે પોતાનું મકાન ગીરવે રાખીને તેના પરથી લોન મેળવી બંને વ્યાજખોરોને પૈસા ચૂકવ્યા છતાં પણ હજુ ધમકી અપાતી હતી અને વધુ મુદ્દલ ૨કમ ની વ્યાજની માંગણી કરાતાં આખરે બંનેના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધા નું કબુલ્યું હોવાથી પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

રોગચાળાનું કારણ જાણવામાં તંત્ર નિષ્ફળ

દહેગામમાં એકાએક ૧૨૨ વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ

અમદાવાદ.તા. ર

દહેગામ તાલુકાના ઝાંક ગામમાં આવેલી જે.એમ. દેસાઈ વિદ્યામંદિરના બાળકોમાં આંખમાં ખંજવાળ, લાલાશ, બળતરા અને ડબલ વિઝન જેવી તકલીફો જોવા મળતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કુલ ૨૨૫ બાળકોમાંથી ૧૨૨ બાળકો આ તકલીફોથી પ્રભાવિત થયા હતા.જેમને ગાંધીનગર સિવિલમાં રાત્રે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ મંગળવારે સવારે તમામનું સ્ક્રીનિંગ કર્યા બાદ તે પૈકી ૧૨૦ બાળકોને રજા આપી દેવામાં આવી છે. જ્યારે બે બાળકોને પણ હજ આડ અસર છે. ઝાંકમાંથી આ ઘટના સામે આવ્યા બાદ, જિલ્લા કક્ષાની ટીમ અને કડાદરા પ્રાથમિક આરોગ્ય

કેન્દ્રની ટીમે તાત્કાલિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસ અને સારવાર સ્થળ પર જ આપવામાં આવી હતી. ત્યારબાદ, ૧૨૨ બાળકોને વધુ તપાસ અને સારવાર <mark>મા</mark>ટે ગાંધીનગર સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તમામ બાળકોની તબિયત હાલ સુધારા પર છે. તેમાંથી ૧૨૦ બાળકોને રજા આપી દેવામાં આવી છે. જ્યારે બે બાળકોને વધુ સારવાર માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.સોમવારે રાત્રે तलझावार गांधीनगर सिविसमां તમામ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અહીં તબીબી સેવા ઉપરાંત સિવિલ તંત્ર દ્વારા આ બાળકોને स्रोप्रन अने भवार-अधीर या

નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી

બ્લડની તપાસ સિવિલમાં કરવામાં આવતા આ તમામ બાળદર્દીઓને રોગચાળા અંતર્ગત ક્રિડની તથા લીવરમાં કોઇ આડઅસર થઇ નથી તેવું રિપોર્ટ ઉપરથી સાબિત થાય છે.

ઝાંકની સ્કૂલના ૧૨૨ જેટલા विद्यार्थीओने આ विચित्र विઝन રોગચાળાની આડ અસર થઇ હતી જેના પગલે ગઇકાલે આ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં તેમને સારવાર આપવામાં આવી હતી તથા લોહી-યુરીન સહિતના વિવિધ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તો બીજીબાજ આરોગ્ય તંત્ર દારા પણ સ્કૂલ તથા છાત્રાલયમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. ફૂડતંત્ર દ્વારા સોમવારે મોડી રાત્રે ચાર સેમ્પલ લેવામાં આવ્યા છે.

Printer's Publisher and Owner's By Navinkumar Gopalbhai Dabgar, and Printed at :Dharti Printers, C/3,Shankar Chambers, Near H.K House, Opp. Bata Showroom, Ashram Road, Navrangpura, Ahmedabad-380009. Place of Publicatin : 39/462, Hariom Appartment, Near Shrinath Appartment, Vyaswadi Road, Nava Wadaj, Ahmedabad-380 013.. RNI NO.: GUJGUJ/1998/00723/ DIVYA GUJARAT (DAILY) EDITOR : Navinkumar Gopalbhai Dabgar

તારીખઃ ૦૩ જુલાઇ, ૨૦૨૫